



મકાન અને અન્ય બાંધકામ શ્રમચોગી
કલ્યાણ સેસ અધિનિયમ, ૧૯૯૬ હેઠળ
સેસની રકમ નક્કી કરવા અંગે.

ગુજરાત સરકાર

શ્રમ અને રોજગાર વિભાગ,

ક્રમાંક: સીડબલ્યુએ/૧૩૨૦૧૩/૨૬૭૨૭/મ(૩)

સચિવાલય, ગાંધીનગર,

તા. ૨૬/૦૯/૨૦૧૩

વંચાણે લીધા:-

- (૧) મકાન અને અન્ય બાંધકામ શ્રમચોગી કલ્યાણ સેસ અધિનિયમ, ૧૯૯૬
- (૨) ભારત સરકાર, શ્રમ મંત્રાલયની તા. ૨૬/૯/૧૯૯૬ ની જાહેરનામા ક્રમાંક: ૨૮૯૯
- (૩) શ્રમ અને રોજગાર વિભાગના તા. ૩૦/૧/૨૦૦૬ ની ઠરાવ ક્રમાંક: સીડબલ્યુએ/૨૦૦૪/૮૪૧/મ(૩)
- (૪) શ્રમ અને રોજગાર વિભાગના તા. ૨/૬/૨૦૦૬ ની ઠરાવ ક્રમાંક: સીડબલ્યુએ/૨૦૦૪/૧૮૩૧/મ(૩)

પ્રાસ્તાવિક:-

ભારત સરકારે બાંધકામ શ્રમચોગીઓના કલ્યાણ માટે મકાન અને અન્ય બાંધકામ શ્રમચોગી (નોકરીનું નિયમન અને સેવાક્ષી શરતો) અધિનિયમ, ૧૯૯૬ અને મકાન અને અન્ય બાંધકામ શ્રમચોગી કલ્યાણ સેસ અધિનિયમ, ૧૯૯૬ ઘડેલાં છે. રાજ્ય સરકારે પણ બાંધકામ શ્રમચોગીઓ માટે મકાન અને અન્ય બાંધકામ શ્રમચોગી (નોકરીનું નિયમન અને સેવાક્ષી શરતો) નિયમો, ૨૦૦૬ બહાર પાડેલ છે. તેમજ આ અધિનિયમ અને નિયમો હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમચોગી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડની આવકનું મુખ્ય સ્ત્રોત મકાન અને અન્ય બાંધકામ શ્રમચોગી કલ્યાણ સેસ અધિનિયમ, ૧૯૯૬ ની કલમ - ૩(૧) અન્વયે બાંધકામના કુલ ખર્ચના ૨% થી વધારે નહીં અને ૧% થી ઓછી નહીં તેટલી રકમની સેસની વસુલાતની છે. ભારત સરકારે વંચાણે લીધા ક્રમાંક - ૬૨ સામેના જાહેરનામાંથી કુલ બાંધકામ ખર્ચની રકમના ૧ ટકા લેખે સેસ વસુલાત કરવાનું કરાવેલ છે. ગુજરાત સરકારે પણ આ બંને કાયદાના અમલીકરણ માટે તા. ૩૦/૧/૨૦૦૬ ના વંચાણે લીધા ક્રમાંક: - ૬૨ ના ઠરાવથી સુચનાઓ બહાર પાડી સરકારના સર્વે વિભાગો, જાહેર નિગમો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કાયદાની જોગવાઈ મુજબ સેસની રકમ ચુકવવા જણાવેલ છે. અને તેમના અંદાજોમાં ૧ ટકા સેસની રકમ ઉમેરીને અંદાજો તૈયાર કરવાની સુચનાઓ આપેલ છે.